

રાજકોટ મહાનગરપાલિકા

ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ - ૩૬૦ ૦૦૧

અખબારી યાદી

તા.૦૪-૦૩-૨૦૨૩

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ "મિક્સ દૂધ (લુઝ)"ના ૩ નમૂના આવેલ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે.



- ફૂડ વિભાગ દ્વારા રાજકોટમાં ડીલેવરી કરતી ગાડી નં. GJ 14 X 9071 માંથી સપ્લાયર શ્રી રમેશભાઈ વેલજીભાઈ સટોડિયા (રેહ. સહજાનંદ સોસોયટી , રેલ્વે સ્ટેશન , ગોંડલ) પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મિક્સ દૂધ(લુઝ)" નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
- ફૂડ વિભાગ દ્વારા નીલકંઠ ડેરી ફાર્મ , રેસકોર્ષ પાર્ક, દુકાન નં. ૧, એરપોર્ટ રોડ, રાજકોટ મુકામેથી શ્રી બાબુભાઈ સવજીભાઈ ઝાલાવાડિયા પાસેથી લેવામાં આવેલ

ખાદ્યચીજ "મિક્સ દૂધ(લુઝ)" નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

- ફૂડ વિભાગ દ્વારા "નંદનવન ડેરી ફાર્મ", દુકાન નં. ૩, ગોકુલ પાર્ક, રણજા મંદિર પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી ભરતભાઈ મનુભાઈ ભૂવા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ "મિક્સ દૂધ(લુઝ)" નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ ફેઇલ જાહેર થયેલ નમૂના અંગેના ૭ કેસ ચાલી જતાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા કુલ મળી રૂ.૧૪,૬૦,૦૦૦/- નો દંડ ના કરવામાં આવેલ છે.

- રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 'મરાસા હોસ્પિટાલિટી પ્રા .લી.',- ડો. રાજેન્દ્ર પ્રસાદ રોડ, લીમડા ચોક, શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ મુકામેથી 'NUTRALITE PROFESSIONAL CREAMYLICIOUS MIXED FAT SPREAD (500 GM PACKED)' નો નમૂનો રિપોર્ટમાં ACID VALUE નું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા (૧)નમૂનો આપનાર પેઢીના નોમીની -હિમાશુંકુમાર સન ઓફ સર્વેન્સિંહને, (૨)નમૂનો આપનાર પેઢી -'મરાસા હોસ્પિટાલિટી પ્રા .લી.ને, (૩)માર્કેટિંગ પેઢીના માલિક -રમેશભાઈ ભીખાભાઈ વાઘેલાને, (૪)ડિસ્ટ્રિબ્યુટર પેઢીના માલિક -કરણ પરેશભાઈ વાઘેલાને, (૫)ઉત્પાદક પેઢીના નોમીની - ઉમાશંકર ગુપ્તાને તથા (૬)ઉત્પાદક પેઢી - ZYDUS WELLNESS LIMITED જવાબદારોને કુલ મળી રૂ.૧૧,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા અગિયાર લાખ પચાસ હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

- ફૂડ વિભાગ દ્વારા "ઓશો મેડીકર", ઓશો હોસ્પિટલ, ઢેબર રોડ, એસ. ટી, બસ પોર્ટ, ત્રીજો માળ, ઓફિસ નં.૧૫, રાજકોટ મુકામેથી "RIMOKS (60 TABLETS PACK)," નો નમૂનો રિપોર્ટમાં લેબલ પર NUTRACEUTICALS નો પ્રકાર તથા FSSAI નો લોગો ની વિગતો લેબલ પર દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા (૧)નમૂનો આપનાર પેઢીના માલિક -

મીનલબેન પરેશભાઈ ચોવટીયાને તથા (૨)ઉત્પાદક પેઢીના માલિક -ઉપેન્દ્રભાઈ ડાયાભાઈ નાથાણીને કુલ મળી રૂ.૧,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પુરા)નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

- ફૂડ વિભાગ દ્વારા "જલીયાણ ધી સેંટર", કોઠારીયા રોડ, દેવપરા શાકમાર્કેટ, રાજકોટ મુકામેથી "શુધ્ધ ધી (લૂઝ)" નો નમુનો રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલ ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક પરેશભાઈ રામણીકભાઈ કોટકને રૂ.૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પાચાસ હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

- ફૂડ વિભાગ દ્વારા "જલારામ ધી ડેપો", વિનાયક નગર, ઉદયનગર -1, અક્ષર પ્લાસ્ટિક & ગ્લાસવેરની સામે, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી "શુધ્ધ ધી (લૂઝ)" નો નમુનો રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) તથા તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક બીરેન પિયુશભાઈ જોબનપુત્રાને રૂ.૫૦,૦૦૦/- (અંકે રૂપિયા પાચાસ હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

- ફૂડ વિભાગ દ્વારા "ગણેશ ડેરી ફાર્મ", રાધેકિજ્જા એપાર્ટમેન્ટ, દુકાન નં. -1, નવલનગર, મવડી મેઇન રોડ, રાજકોટ મુકામેથી "કેસર શીખંડ (લુઝ)" નો નમુનો રિપોર્ટમાં SYNTHETIC FOOD COLOUR TARTRAZINE ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક- શૈલેષભાઈ માવજીભાઈ ટીલાળા ને રૂ.૧૫,૦૦૦/- (અંકે રૂપિયા પંદર હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

- ફૂડ વિભાગ દ્વારા "CAKE N JOY", શ્યામ કોમ્પ્લેક્ષ, દુકાન નં. 6, સ્વામિનારાયણ ચોક, રાજકોટ મુકામેથી લેવાયેલ "CAKE N JOY ALMOND COOKIES (200 GM PACKED)" નો નમુનો રિપોર્ટમાં લેબલ પર પેકિંગ/ ઉત્પાદનની તારીખ દર્શાવેલ ન હોવાના કારણે નમૂનો મિસબ્રાન્ડેડ ફૂડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડિકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા (૧)નમુનો આપનાર પેઢીના સંચાલક -મલયભાઈ ધનશ્યામભાઈ કોટકને, (૨)રિટેલર પેઢીના માલિક -જીતેશભાઈ રતિલાલ મોરઝરીયાને, (૩)ઉત્પાદક પેઢીના નોમિની -સંજયભાઈ હંસરાજભાઈ ગોવાણીને તથા (૪)ઉત્પાદક પેઢીને -SKY FOODS ને કુલ મળી રૂ.૮૦,૦૦૦/- (અંકે રૂપિયા નેવું હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

• ફૂડ વિભાગ દ્વારા "નકલંક ડેરી", દુકાન નં. 37/38, સિંદૂરિયા શોપિંગ સેન્ટર, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી "મેંગો શિખંડ (લુઝ)"નો નમુનો રિપોર્ટમાં SYNTHETIC FOOD COLOUR SUNSET YELLOW FCF અને TARTRAZINE ની હાજરી મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ. જે અંગેના કેસમાં નામદાર એજ્યુડીકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજકોટ દ્વારા નમુનો આપનાર પેઢીના માલિક- રોહિતભાઈ જીવરાજભાઈ ત્રાપસિયા ને રૂ.૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) નો દંડનો હુકમ કરવામાં આવેલ છે.

ડેઝીઝનેટેડ ઓફિસર
રાજકોટ મહાનગરપાલિકા